

October 11, 2021

To,
Department of Corporate Service
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai – 400 001.

Dear Sir,

Sub: Proposed buyback of 27,00,000 equity shares of face value Rs. 10 each for cash at a price of Rs. 70/- per equity share for cash aggregating upto Rs. 18,90,00,000 (Rupees Eighteen Crores Ninety Lacs only) pursuant to regulation 5(iv), 5(vii) and 7(i) of extant SEBI (Buyback of Securities) Regulations, 2018, (including its amendments), ("SEBI Regulations") through Tender Offer route, ("Buyback Offer") by Mahalaxmi Rubtech Limited, ("Company")

We have been appointed as 'Manager' to the captioned Buyback Offer by the Company. In this regard, we are enclosing the following for your kind reference and records:

1. A copy of Addendum Advertisement dated October 09, 2021, ("**Addendum**"). The Addendum was published on October 10, 2021 in the following newspapers:-


Sr. No.	Newspapers	Editions
1	Financial Express	English (National Wide)
2	Janasatta	Hindi (National Wide)
3	Financial Express*	Gujarati - Registered Office (Regional)*

*Due to technical issue the advertisement was published on October 11, 2021.

In case of any clarification required, please contact the undersigned on (D) 022 4082 0915/ 9769340475, Email- gaurav@saffronadvisor.com.

We will arrange to submit the covering letter along with other original documents once our office resumes. We request you to kindly consider the attachments as good compliance and disseminate it on your website.

For Saffron Capital Advisors Private Limited



Gaurav Khandelwal
Vice President
Equity Capital Markets
Encl: a/a



JM FINANCIAL MUTUAL FUND NOTICE



Uploading half yearly portfolio for the period ended September 30, 2021 for the schemes of JM Financial Mutual Fund:

Notice is hereby given that in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with SEBI circular no. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 05, 2018, the statement of portfolio of the schemes of JM Financial Mutual Fund ("the Fund") for the half year ended September 30, 2021 has been hosted on the website of the Fund viz www.jmfinancialmf.com and on the website of AMFI viz www.amfiindia.com.

The Portfolio/s of the respective scheme/s has/have been sent to all the investors whose email ids are registered with us. However, while the investors can refer to any of the above sites for the scheme's portfolio pertaining to their respective investments, they can also request for a physical/ soft copy thereof through any of the following means:

- Telephone:** Call our toll free number at 1800 1038 345
- E-Mail:** Send an email to investor@jmf.com
- Letter:** Submit a letter at any of the Investor Service Centres of the Fund or Registrar M/s. KFin Technologies Pvt Ltd., details of which are available at www.jmfinancialmf.com.

Unit holders are requested to take note of the aforesaid.

Place : Mumbai Authorised Signatory
JM Financial Asset Management Limited
(Investment Manager to JM Financial Mutual Fund)
Date : October 9, 2021

For further details, please contact :
JM Financial Asset Management Limited
(Formerly known as JM Financial Asset Management Private Ltd.),
Registered Office: 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400025.

Corporate Office: Office B, 8th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai-400025.
Corporate Identity Number: U65991MH1994PLC078879. • Tel. No.: (022) 6198 7777
• Fax No.: (022) 6198 7704. • E-mail: investor@jmf.com • Website : www.jmfinancialmf.com

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully. REF No. 18/2021-22

IDFC
IDFC MUTUAL FUND

NOTICE

Half-Yearly Portfolio Statement of schemes of IDFC Mutual Fund:

NOTICE is hereby given that pursuant to Regulation 59A of SEBI (Mutual Funds) Regulations, 1996 and SEBI Circular dated June 05, 2018 on Go Green Initiative, half-yearly portfolio statement of schemes of IDFC Mutual Fund for period ended September 30, 2021 has been hosted on the website of IDFC Mutual Fund - <https://www.idfcmf.com> and on the website of Association of Mutual Funds in India (AMFI) - www.amfiindia.com. Investors can view or download the same from the website of the IDFC Mutual Fund.

Investors can also request for the physical/soft copy of portfolio statement of schemes through any of the following modes:

- Send an email to investor@idfc.com.
- Submit a letter at any of the AMC Offices or our CAMS Investor Service Centres, details of which are available on the www.idfcmf.com.
- Contact us at our toll free number 1-800-2666688/1-800-3006688

Place : Mumbai
Date : October 09, 2021

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

PPFAS
MUTUAL FUND
There's only one right way!

Disclosure / Hosting of Half Yearly Portfolio of the Schemes of PPFAS Mutual Fund

All unit holders of PPFAS Mutual Fund are requested to note that in terms of Regulation 59A of SEBI (Mutual Funds) Regulations, 1996 and SEBI circulars issued in this regard from time to time, the Half Yearly Portfolio for the period ended September 30, 2021 of Schemes of PPFAS Mutual Fund have been hosted on the website of PPFAS Mutual Fund viz; www.amc.ppfas.com and on the website of Association of Mutual Funds in India, www.amfiindia.com. Investors can access / download the half yearly disclosure from the above-mentioned websites.

Investors are requested to take note of the same.

Further, investors can submit a request for a physical or electronic copy of half yearly portfolio for the period ended September 30, 2021 by any of the following modes at free of cost:

- Email to us at mf@ppfas.com or
- Contact us at Investor Helpline no. 1800-266-7790 or
- Sending a written request at the Registered office address of the PPFAS Asset Management Private Limited as given below.

For PPFAS Asset Management Private Limited
(Investment Manager to PPFAS Mutual Fund)
Sd/-
Director

Place: Mumbai
Date: 09th October, 2021

Name of Mutual Fund: PPFAS Mutual Fund

For more information please contact:
PPFAS Asset Management Private Limited (Investment Manager for PPFAS Mutual Fund)
CIN No. : - U65100MH2011PTC220623
Registered Office: - 81/82, 8th Floor, Sakhar Bhavan, Ramnath Goenka Marg,
230 Nariman Point, Mumbai - 400 021, INDIA. Tel.: 91 22 6140 6555 Fax: 91 22 6140 6590.
E-mail: mf@ppfas.com. Website: www.amc.ppfas.com. Toll Free Number: 1800-266-7790.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

ICICI Prudential Asset Management Company Limited
Corporate Identity Number: U99999DL1993PLC054135

Registered Office: 12th Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001.
Corporate Office: One BKC, 13th Floor, Bandra Kurla Complex, Mumbai - 400 051.
Tel.: +91 22 2652 5000, Fax: +91 22 2652 8100, Website: www.icicipruamc.com,
Email id: enquiry@icicipruamc.com
Central Service Office: 2nd Floor, Block B-2, Nirlon Knowledge Park, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063. Tel.: 022 2685 2000 Fax: 022 26868313

Notice to the Investors/Unit holders of ICICI Prudential Mutual Fund
Half-Yearly Portfolio Statement of Schemes

NOTICE is hereby given that the half-yearly portfolio statement of schemes of ICICI Prudential Mutual Fund for half year ended September 30, 2021 shall be hosted on October 10, 2021 on the website of ICICI Prudential Asset Management Company Limited (the AMC) viz. www.icicipruamc.com and on the website of Association of Mutual Funds in India (AMFI) viz. www.amfiindia.com in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996, read with SEBI Circular No. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 5, 2018.

Investors may accordingly view/download the portfolio statement of schemes from the website of the AMC.

Investors can also request for the physical/soft copy of portfolio statement of schemes through any of the following modes:

- Give a call at our Contact Centre at:
 - MTNL/BSNL: 1800 222 999
 - Others: 1800 200 6666
- Send an email to enquiry@icicipruamc.com
- Submit a letter at any of the AMC Offices or our CAMS Investor Service Centres, details of which are available on the AMC website viz. www.icicipruamc.com.

For ICICI Prudential Asset Management Company Limited
Sd/-
Authorised Signatory

Place : Mumbai
Date : October 09, 2021
No. 003/10/2021

To know more, call 1800 222 999/1800 200 6666 or visit www.icicipruamc.com

As part of the Go Green Initiative, investors are encouraged to register/update their e-mail id and mobile number to support paper-less communications.

To increase awareness about Mutual Funds, we regularly conduct Investor Awareness Programs across the country. To know more about it, please visit <https://www.icicipruamc.com> or visit AMFI's website <https://www.amfiindia.com>

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

HDFC
MUTUAL FUND
BHAROSA APNO KA

HDFC Asset Management Company Limited
A Joint Venture with Standard Life Investments
CIN: L65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676
Fax: 022 22821144 • e-mail: hello@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

NOTICE

Half-Yearly Portfolio Statement of Schemes of HDFC Mutual Fund

NOTICE is hereby given that the statement of a complete Portfolio of the Schemes of HDFC Mutual Fund ("the Fund") for the half-year ended September 30, 2021 has been hosted on the website viz. www.hdfcfund.com and on the AMFI website viz. www.amfiindia.com.

Unit holders can submit a request for a physical or electronic copy of the statement of scheme portfolio by any of the following modes:

- call on our toll free number(s):
 - Within India: 1800 3010 6767 / 1800 419 7676;
 - From abroad: 91 44 3346 2406; or
- email us at hello@hdfcfund.com; or
- SMS 'HDFCFM' to 56767 and the call center of the Fund will get in touch to cater the requests.

For HDFC Asset Management Company Limited
(Investment Manager to HDFC Mutual Fund)
Sd/-
Authorized Signatory

Place : Mumbai
Date : October 9, 2021

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

भारतीय स्टेट बैंक
भारतीय स्टेट बैंक
STATE BANK OF INDIA

Authorised Officer's Details:
Name: Smt.S.Gayathri,
Asst. General Manager,
E-mail id: gayathri.s@sbi.co.in

Address of the Branch: 1st Floor, D. No.3-4-1013/A,
1st Floor, CAC,TSRTC Bus Station, Kacheguda,
Hyderabad. Telephone: 040 - 23147100 to 23147107
Fax No.: 040 -29807791, E-mail id: sbi.18359@sbi.co.in

"APPENDIX-IV-A"

SALE NOTICE FOR SALE OF MOVABLE/IMMOVABLE PROPERTIES
[Proviso to rule 6(2) & 8(6) of Security Interest (Enforcement) Rules]

E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6(2) & 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described movable/immovable properties mortgaged/charged to State Bank of India, the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of State Bank of India, the Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 27.10.2021 for recovery of Rs.244,07,40,627.59 (Rupees Two Hundred Forty Four crore Seven Lakh forty thousand Six Hundred Twenty seven and paise Fifty Nine only) as on 19.06.2014 plus interest at the contractual rate from 20.06.2014 minus recoveries if any and incidental charges and costs etc. due to the State Bank of India, Stressed Assets Management Branch-II, Kachiguda, Hyderabad, from the Borrower(s): 1) M/s. Good Health Agro Tech Pvt Ltd, 2) Shri Subash Chandra Agarwal, 3) Shri Kailash Chandra Agarwal, 4) Shri Vinod Kumar Agarwal, 5) Smt Lata Devi Agarwal, 6) Smt. Komal Devi Agarwal, 7) Smt. Kusum Devi Agarwal, 8) M/s. Nikhil Refineries Pvt Ltd, 9) Shri Subash Chandra Agarwal, 10) Shri Kailash Chandra Agarwal, 11) Shri Vinod Kumar Agarwal, 12) Smt. Akash Kumar Agarwal, 13) Shri Amit Kumar Agarwal, 14) Shri Sandeep Kumar Agarwal, 15) Smt. Komal Devi Agarwal, 16) Smt. Kusum Devi Agarwal and 17) Smt. Banwari Bai Agarwal W/o late Banwarilal Agarwal.

SCHEDULE OF THE PROPERTIES

1. Lot No.1: (Plant & Machinery)

(a) All Plant & Machinery of 300 TPD capacity Edible Oil Factory along with other movable assets hypothecated to Bank belonging to M/s Good Health Agro Tech Pvt Ltd erected/situated on the factory premises described below in property serial Nos. Lot-II A & B below.

(b) All Plant & Machinery of 200 TPD capacity Edible oil factory along with other movable assets hypothecated to Bank belonging to M/s Nikhil Refineries Pvt Ltd erected/situated on the factory premises described below in property serial No Lot-II-E below

Lot No.2: (Immovable Property comprising Factory land & Building there on)

(a) Factory land extent Ac.0.76 Cents Sy.Nos. 268/20 part, 268/22 part, 268/23 part, 268/25 part and 268/26 part situated at Thammavaram village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P belonging to M/s M/s Good Health Agro Tech Pvt Ltd.

(b) Land admeasuring Ac.0.40.6 Cents in Sy.No.268/23part, 268/26 part, 268/6 part situated at Thammavaram village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P. belonging to M/s Good Health Agro Tech Pvt Ltd.

(c) Factory land in Sy.No.268/13, 274/3 and 268/17 admeasuring Ac.1.50 Cents situated at Thammavaram Village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P belonging to M/s Good Health Agro Tech Pvt Ltd.

(d) All that Land on Sy.Nos.268/18,268/19,268/20,268/21,268/20 Part, admeasuring Ac.1.24 cents, situated at ADB Road, near to Vakalpuadi Light House, Thammavaram Village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P registered in the name of M/s Nikhil Refineries Pvt Ltd.

(e) All that Land & building constructed on Sy.Nos: 281/1, 281/2, 281/3, 281/4, 281/5part, 268/14P, 268/15P, 268/16P, 268/17P, 274/3 Part, admeasuring Ac.5.00 cents, situated at ADB Road, near to Vakalpuadi Light House, Thammavaram Village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P. belonging to M/s Nikhil Refineries Pvt Ltd.

S.No.	Property to be auctioned	Date & Time of auction	Reserve Price Below which the property will not be sold (In Rs.)	Earnest Money Deposit (In Rs.)	Date of receipt of EMD
1	Lot No. 1(a & b)	10.30 AM to 11.30 AM on 27.10.2021	9,62,00,000/-	96,20,000/-	26.10.2021 Upto 5.00 pm
2	Lot No. 2 (a,b,c,d & e) together	11.00 AM to 12.00 Noon on 27.10.2021	20,56,00,000/-	2,05,60,000/-	26.10.2021 Upto 5.00 pm

EMD Remittance: The intending bidders have to get themselves registered on the INDIAN BANKS AUCTION PROPERTIES INFORMATION (IBAPI) PORTAL (<https://www.msccommerce.com/auctionhome/ibapi/index.jsp>) for participation in the e-auction process. The Bidders have to register themselves well before the auction date as registration of bidders takes minimum of three working days. The intending bidder should submit the EMD deposit to IBAPI wallet in IBAPI portal through their Bank account.

For inspection and any clarifications, the intending bidders may contact the Manager Shri V. Srinivas Sharma on Mobile No.9346203999 or Bank's Approved Resolution Agent M/S Goodwill Associates, on Cell Nos.9949901281 or 9848327119.

Note: This is also a notice to the Borrower/ Guarantors of the said loan about holding of e-auction sale of the property on the aforesaid mentioned date if the dues are not repaid in full before the date of e-auction. For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India, the Secured Creditor's website (a) "<http://www.sbi.co.in>" (b) <https://ibapi.in>

Bidders may submit a single bid for all the properties mentioned in lots 1 & 2 above OR submit their bids for Plant & Machinery mentioned in Lot No.1(a&b) only.

However, Bids for Lot No.1 (a&b) will be considered only if there are no bids for lots 1 & 2 together.

Intending Bidders are hereby informed that the borrowers have filed SA Nos 128 of 2020 & SA No 129 of 2020 at DRT Hyderabad. This auction sale shall be subject to outcome of the mentioned Sas.

GST & taxes (if any) has to be borne by successful bidders over & above the bid amount.

Date:06.10.2021 Place: Hyderabad Sd/- Authorized Officer, State Bank of India, SAMB-II, Hyderabad.

MAHALAXMI RUBTECH LIMITED
(Corporate Identification Number: L25190GJ1991PLC16327)
Registered Office: 47, New Cloth Market, Ahmedabad - 380002, Gujarat, India;

Corporate Office: Mahalaxmi House, Ysl Avenue, Opp. Ketav Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad - 380 015, Gujarat, India;
Tel. No.: +91 79 40008000; Fax: +91 79 40008030;
Email: cs@mahalaxmigroup.net; Website: www.mrtglobal.com;
Contact Person: Mr. Kevin Dhruve, Company Secretary and Compliance Officer.

This Advertisement is being issued by Saffron Capital Advisors Private Limited, on behalf of Mahalaxmi Rubtech Limited, pursuant to the Securities and Exchange Board of India (Buy Back of Securities) Regulations, 2018 (The "Buyback Regulations") for the time being in force including any statutory modifications and amendments from time to time in respect of the buyback offer of the Mahalaxmi Rubtech Limited ("Offer").

Kind Attention- Physical Shareholders

Eligible Shareholders holding Equity Shares in physical form and who have not received the physical copy of LoF for any reason whatsoever, may send request to Registrar & Transfer Agent to the Offer, Cameo Corporate Services Limited at priya@cameoindia.com and avail soft copy of the LoF. Alternatively, Eligible Shareholders may also download the soft copy of LoF from the website of SEBI's website, www.sebi.gov.in or Manager to the Offer, www.saffronadvisor.com or Company, www.mrtglobal.com. Eligible Shareholders are required to refer to the Section titled "Process and methodology to be adopted for the buy-back" at page 39 of the LoF in relation to inter alia the procedure for tendering their Equity Shares in the buyback Offer and are required to adhere to and follow the procedure outlined therein. Capitalised terms used but not defined in this Advertisement shall have the same meanings assigned to such terms in the Public Announcement/DLOF/LOF. The Board of Directors of the Company accept full responsibility for the information contained in this Advertisement and also for the obligations of the Company as laid down in Securities and Exchange Board of India (Buy Back of Securities) Regulations, 2018 (The "Buyback Regulations").

Issued by the Manager to the Offer on behalf of the Company

SAFFRON
emerging ideas

Saffron Capital Advisors Private Limited
(Corporate Identification Number: U67120MH2007PTC166711)
605, Sixth Floor, Centre Point, Andheri-Kurla Road, J. B. Nagar, Andheri (East), Mumbai - 400 059
Tel. No.: +91 22 4082 0914/915 Fax No.: +91 22 4082 0999
Email id: buybacks@saffronadvisor.com Website: www.saffronadvisor.com
Investor grievance: investorgrievance@saffronadvisor.com
SEBI Registration Number: INM00011211
Contact Person: Amit Wagle / Gaurav Khandelwal
Place: Ahmedabad
Date: October 09, 2021

indianexpress.com

I arrive at a conclusion
not an assumption.

Inform your opinion with
detailed analysis.

The Indian Express.
For the Indian Intelligent.

The Indian EXPRESS
— JOURNALISM OF COURAGE —

L&T Financial Services
Mutual Fund

L&T Mutual Fund
6th Floor, Brindavan, Plot No. 177
C. S. T. Road, Kalina
Santacruz (East), Mumbai 400 098

call 1800 2000 400
email investor.line@lntmf.co.in
www www.ltfs.com

NOTICE (No. 43 of F.Y. 2021 – 2022)

Notice is hereby given that in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with SEBI circular no. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 05, 2018, the half-yearly statement of scheme portfolio of L&T Mutual Fund ("the Fund") for the half-year ended September 30, 2021 has been hosted on the website of the Fund viz. www.ltfs.com and on the website of AMFI viz. www.amfiindia.com.

Investors can request for physical/soft copy of statement of scheme portfolio through any of the following means:

- SMS:- Send SMS to 567678 from investor's registered mobile number. SMS format "LTMFHE <Space>Folio no. for soft copy and LTMFHP <Space>Folio no. for physical copy.
- Telephone:- Give a call at our toll-free no. at 1800 2000 400 & 1800 4190 200
- E-mail:- Send an email to investor.line@lntmf.co.in
- Letter:- Submit a letter at any of the AMC Offices or CAMS investor Service Centres, details available at www.ltfs.com.

Investors/ Unit holders are requested to take note of the aforesaid.

For L&T Investment Management Limited
CIN: U65991MH1996PLC229572
(Investment Manager to L&T Mutual Fund)

Date : October 09, 2021
Place: Mumbai
Sd/-
Authorised Signatory

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

CL08734
Ahmedabad

